https://archive.org/details/bk912/page/n0/mode/1up

2012-11-19 -Manoj Tulsi Nakrani - Mari Vedana (912)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

તા. ૧૯-૧૧-૨૦૧૨

જય માતાજી

''મારી વેદના''

મારી સમાજ ઉપર મને ખુબજ પ્રેમ છે. લાગણી છે. સમાજ મારો પરિવાર છે. પરિવારના કોઈ પણ સદસ્યનું સુખ-દુ:ખ ને મારૂ સમજુ છું. એટલા માટે મને આજની પરિસ્થિતી માટે ખુબજ દુ:ખ થાય છે. મારો લેખ વાચવાવાળા ને મારા આસું કદાપી નહી દેખાય. મને કોઈ મુર્ખ પણ સમજતું હશે કે આને શું આટલી ચિંતા કરવાની હોય. 'મારી સમાજ' નો ભાવ શું ફક્ત મનોજ ને જ છે?

અને આ હકીકત ને નાતે હું કચ્છ કડવા પાટીદાર સમાજ કે પરિવારનું સંતાન છું અને આપણી અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજ ના પ્રથમ પ્રમુખ સ્વ. શીવદાસ કાનજી નાકરાણી નો પૌત્ર છું. હું વિશ્વ આખાને પ્રેમ કરૂ છું અને આતો આપણા ભાઈઓ જ છે તો શા માટે મારો જીવ ન બળે?

સમય નો કાળો પડછાયો કેટલાક વર્ષો પહેલા આપણી સમાજ ને ભરખી ગયો હતો અને વિવાદ ઉભો થઈ ગયો. કચ્છ કડવા પાટીદાર નું પ્રથમ બંધારણ બન્યું ત્યારે લગભગ ૧૫% જેટલા સનાતન અને લગભગ ૮૫% જેટલા જુના ધર્મ માં માનતા હતા આજે પરિસ્થિતી એ વંળાક લઈને આના થી ટકાવારી ઉલટી થઈ ગઈ છે.

છેલ્લા ૫૦ વર્ષમાં ધીરે ધીરે પણ આખરે ઘણું પરિવર્તન આવી ગયું છે. આ પરિવર્તનના પ્રણેતા નારણ બાપાએ કરશનદાસ બાપાને જ્યારે અંગુલી નિર્દેશન કર્યું ત્યાર થી સત પંથી ભાઈઓ ને બીજા ધર્મના પડછાયા થી કે આવરણ થી મુક્ત કરવા કરશનદાસ બાપા એ કમર કસી. ગામે ગામ જઈ જુના ધર્મ ની ચોપડીઓ ને મુળ હિંદુ ધર્મ ના આધાર ઉપર ફરી થી લઈ આવવા ફેરફાર કરાવા લાગ્યા. આ નિવેદન કે હકીકત મને સત્તપંથી ભાઈ દ્વારા જ મળી.

અને હું મારી આગળની વિગતો તમને જણાવતા પહેલા સ્પષ્ટ કરી દઉ કે ૧૦ માર્ચ ૨૦૧૨ ના મારા ''પાટીદાર સંદેશ'' માં છપાયેલ ''સમાજની એકતા અંગે થોડુક'' ના લેખ ના સંદર્ભમાં ઘણા ફોનો આવ્યા હતા અને તેમાં નિખાલસતા થી ઘણી વાતો થઈ હતી. એ ફોનોમાં આપણી સમાજ ના દરેક સંપ્રદાય ના ઘણા ભાઈઓ હતા. તેમની સાથે વાત કરી ઘણી વિગતો જાણવા મળી.

કચ્છ કડવા પાટીદાર સમાજની જે કલમો બનાવેલી છે તે સહુને સ્વીકાર્ય હોવી જોઈએ તે મારૂ પણ સ્પષ્ટ પણે માનવું છે. અને સતપંથી ભાઈઓ પણ આ સ્વીકારી રહ્યા છે. અગ્નિ સંસ્કારની બાબત લઈએ તો આજનો મોટો યુવા વર્ગ તે સહજ સ્વીકારવા તૈયાર છે અને અગ્નિ સંસ્કાર કરી જ રહ્યા છે.

મારો જીવ એટલા માટે બળે છે કે આજની પરિસ્થિતી એ આપણી કેટલીઓ દીકરીઓને રડાવી છે અને આગળ જતા કેટલીએ દીકરી ઓ રડશે? આજની ઉભી થયેલી પરિસ્થિતીએ કેટલીએ સગાઈઓ તુટી છે. તેમાં સનાતન ભાઈઓ અને સતપંથી ભાઈઓ ના દીકરા અને દીકરી ઓનો સમાવેશ થયેલ છે. બન્ને ભાઈઓના પરિવારમાં દુ:ખ ઉભું થયું છે.

જે ભાઈઓ દ્વારા આ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તેમનો જરા પણ હું વિરોધી નથી. ફક્ત મારા ભાઈઓને હું હૃદયપૂર્વક વિનંતી કરૂં છું કે જો સતપંથી ભાઈઓ આપણી સાથે ભળવા તૈયાર છે તો એ બાબતમાં હવે જીદ છોડી અવશ્ય કંઈક વિચારવું જોઈએ.

પ્રેરણા પીઠ ના ટ્રસ્ટી સાથે મારી વાત થઈ તેમણે પણ સનાતની ભાઈઓ ને પુરો સહકાર આપશું તેમનું કહેવું એ છે કે સનાતની ભાઈઓ અમારી ઉપર પુરો વિશ્વાસ રાખે. જાગૃતિ આવ્યા પછી અમે એવું એક પણ આચરણ (નવી ચોપડીના આધારે) કરતા નથી કે જે હિંદુ ધર્મ કે સનાતન ધર્મ ને ઠેસ પહોંચાડે. અમે અમારી ધર્મની બાબતમાં હવે પછી કલકી રૂપે અવતાર લેનાર ભગવાન ની વિશેષ રૂપે પુજા કરીએ છીએ. જેમાં મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા આદ્યશક્તિ મા ઉમિયા મા નો દિવો હોય છે તથા એક પાટ રાખવા માં આવે છે જેની ઉપર ભગવાન નિરાકાર સ્વરૂપે બિરાજમાન છે.

સુન્નતની બાબતમાં પણ એમણે સ્પષ્ટ કહ્યું કે ખાત્રી કરવી હોય તો તેઓ કોઈપણ સતપંથી ભાઈનો મેડીકલ ચેક અપ કરાવી શકો છો.

અમૂક જ સતપંથી ભાઈઓના ઘરોમાં આજે પણ જુની ચોપડી થી પૂજા વિધી થાય છે. જેનો ઘણા સતપંથી ભાઈઓ તથા સંસ્થાનો પણ વિરોધ છે જ. આ બાબતે સનાતની ભાઈઓ તથા કેન્દ્રીય સમાજનો સાથ સહકાર મળે તો ઘણું સારૂં પરિણામ મળી શકે.

એક યુવાન સતપંથી દ્વારા મને એમ પણ જાણવા મળ્યું કે આ અભિયાન કે જાગૃતિ ની ઝુંબેશ માં અમને યુવા વર્ગ ને પણ ઘણું જાણવા મળ્યું તેમના અમે આભારી છીએ. પરંતુ અમુક વેબસાઈટ દ્વારા જે ખોટો પ્રચાર થઈ રહ્યો છે જેવો કે 'તાકીયા' વગેરે આ વિશે ખરેખર અમને કંઈ જ ખબર નથી અને કદાચ આવું કંઈક હશે તો તે બહુજ જુની વાત હશે. ત્યારે અમને ખુબજ દુ:ખ લાગે છે કે અમે આ કોને કહેવા જઈએ અને હકીકત જોતા જેમ આજનો સનાતની યુવા વર્ગ આ બધી બાબતો થી અજાણ હતો એમ અમારો સતપંથી યુવા વર્ગ પણ અજાણ હતો અને છીયે. એટલે આમા નવ યુવાનો ન ઉશ્કેરાતા અમને થોડો સમય આપો અને સાથ આપો તો ઘણું સારૂં પરિણામ આવી શકે.

ખારઘર (નવી મુંબઈ) માં વસતા એક અગ્રણી સતપંથી બીલ્ડરે ત્યાં સુધી કહ્યું કે અમને છ એક મહીના

realpatidar.com

https://archive.org/details/bk912/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

realpatidar.com

તા. ૧૯-૧૧-૨૦૧૨

જય માતાજી

''મારી વેદના''

મારી સમાજ ઉપર મને ખુબજ પ્રેમ છે. લાગણી છે. સમાજ મારો પરિવાર છે. પરિવારના કોઈ પણ સદસ્યનું સુખ-દુઃખ ને મારૂ સમજુ છું. એટલા માટે મને આજની પરિસ્થિતી માટે ખુબજ દુઃખ થાય છે. મારો લેખ વાંચાવાવાળા ને મારા આસું કદાપી નહી દેખાય. મને કોઈ મુર્ખ પણ સમજતું હશે કે આને શું આટલી ચિંતા કરવાની હોય. 'મારી સમાજ' નો ભાવ શું ફક્ત મનોજ ને જ છે?

અને આ હકીકત ને નાતે હું કચ્છ કડવા પાટીદાર સમાજ કે પરિવારનું સંતાન છું અને આપણી અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજ ના પ્રથમ પ્રમુખ સ્વ. શીવદાસ કાનજી નાકરાણી નો પૌત્ર છું. હું વિશ્વ આખાને પ્રેમ કરૂ છું અને આતો આપણા ભાઈઓ જ છે તો શા માટે મારો જીવ ન બળે?

સમય નો કાળો પડછાયો કેટલાક વર્ષો પહેલા આપણી સમાજ ને ભરખી ગયો હતો અને વિવાદ ઉભો થઈ ગયો. કચ્છ કડવા પાટીદાર નું પ્રથમ બંધારણ બન્યું ત્યારે લગભગ ૧૫% જેટલા સનાતન અને લગભગ ૮૫% જેટલા જુના ધર્મ માં માનતા હતા આજે પરિસ્થિતી એ વંળાક લઈને આના થી ટકાવારી ઉલટી થઈ ગઈ છે.

છેલ્લા ૫૦ વર્ષમાં ધીરે ધીરે પણ આખરે ઘણું પરિવર્તન આવી ગયું છે. આ પરિવર્તનના પ્રણેતા નારણ બાપાએ કરશનદાસ બાપાને જ્યારે અંગુલી નિર્દેશન કર્યું ત્યાર થી સત પંથી ભાઈઓ ને બીજા ધર્મના પડછાયા થી કે આવરણ થી મુક્ત કરવા કરશનદાસ બાપા એ કમર કસી. ગામે ગામ જઈ જુના ધર્મ ની ચોપડીઓ ને મુળ હિંદુ ધર્મ ના આધાર ઉપર ફરી થી લઈ આવવા ફેરફાર કરાવા લાગ્યા. આ નિવેદન કે હકીકત મને સત્તપંથી ભાઈ દ્વારા જ મળી.

અને હું મારી આગળની વિગતો તમને જણાવતા પહેલા સ્પષ્ટ કરી દઉ કે ૧૦ માર્ચ ૨૦૧૨ ના મારા ''પાટીદાર સંદેશ'' માં છપાયેલ ''સમાજની એકતા અંગે થોડુક'' ના લેખ ના સંદર્ભમાં ઘણા ફોનો આવ્યા હતા અને તેમાં નિખાલસતા થી ઘણી વાતો થઈ હતી. એ ફોનોમાં આપણી સમાજ ના દરેક સંપ્રદાય ના ઘણા ભાઈઓ હતા. તેમની સાથે વાત કરી ઘણી વિગતો જાણવા મળી.

કચ્છ કડવા પાટીદાર સમાજની જે કલમો બનાવેલી છે તે સહુને સ્વીકાર્ય હોવી જોઈએ તે મારૂ પણ સ્પષ્ટ પણે માનવું છે. અને સતપંથી ભાઈઓ પણ આ સ્વીકારી રહ્યા છે. અગ્નિ સંસ્કારની બાબત લઈએ તો આજનો મોટો યુવા વર્ગ તે સહજ સ્વીકારવા તૈયાર છે અને અગ્નિ સંસ્કાર કરી જ રહ્યા છે.

મારો જીવ એટલા માટે બળે છે કે આજની પરિસ્થિતી એ આપણી કેટલીઓ દીકરીઓને રડાવી છે અને આગળ જતા કેટલીએ દીકરી ઓ રડશે? આજની ઉભી થયેલી પરિસ્થિતીએ કેટલીએ સગાઈઓ તુટી છે. તેમાં સનાતન ભાઈઓ અને સતપંથી ભાઈઓ ના દીકરા અને દીકરી ઓનો સમાવેશ થયેલ છે. બન્ને ભાઈઓના પરિવારમાં દુઃખ ઉભું થયું છે.

જે ભાઈઓ દ્વારા આ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તેમનો જરા પણ હું વિરોધી નથી. ફક્ત મારા ભાઈઓને હું હૃદયપૂર્વક વિનંતી કરૂં છું કે જો સતપંથી ભાઈઓ આપણી સાથે ભળવા તૈયાર છે તો એ બાબતમાં હવે જીદ છોડી અવશ્ય કંઈક વિચારવું જોઈએ.

પ્રેરણા પીઠ ના ટ્રસ્ટી સાથે મારી વાત થઈ તેમણે પણ સનાતની ભાઈઓ ને પુરો સહકાર આપશું તેમનું કહેવું એ છે કે સનાતની ભાઈઓ અમારી ઉપર પુરો વિશ્વાસ રાખે. જાગૃતિ આવ્યા પછી અમે એવું એક પણ આચરણ (નવી ચોપડીના આધારે) કરતા નથી કે જે હિંદુ ધર્મ કે સનાતન ધર્મ ને ઠેસ પહોંચાડે. અમે અમારી ધર્મની બાબતમાં હવે પછી કલકી રૂપે અવતાર લેનાર ભગવાન ની વિશેષ રૂપે પુજા કરીએ છીએ. જેમાં મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા આદ્યશક્તિ મા ઉમિયા મા નો દિવો હોય છે તથા એક પાટ રાખવા માં આવે છે જેની ઉપર ભગવાન નિરાકાર સ્વરૂપે બિરાજમાન છે.

સુન્નતની બાબતમાં પણ એમણે સ્પષ્ટ કહ્યું કે ખાત્રી કરવી હોય તો તેઓ કોઈપણ સતપંથી ભાઈનો મેડીકલ ચેક અપ કરાવી શકો છો.

અમૂક જ સતપંથી ભાઈઓના ઘરોમાં આજે પણ જુની ચોપડી થી પૂજા વિધી થાય છે. જેનો ઘણા સતપંથી ભાઈઓ તથા સંસ્થાનો પણ વિરોધ છે જ. આ બાબતે સનાતની ભાઈઓ તથા કેન્દ્રીય સમાજનો સાથ સહકાર મળે તો ઘણું સારૂં પરિણામ મળી શકે.

એક યુવાન સતપંથી દ્વારા મને એમ પણ જાણવા મળ્યું કે આ અભિયાન કે જાગૃતિ ની ઝુંબેશ માં અમને યુવા વર્ગ ને પણ ઘણું જાણવા મળ્યું તેમના અમે આભારી છીએ. પરંતુ અમુક વેબસાઈટ દ્વારા જે ખોટો પ્રચાર થઈ રહ્યો છે જેવો કે 'તાકીયા' વગેરે આ વિશે ખરેખર અમને કંઈ જ ખબર નથી અને કદાચ આવું કંઈક હશે તો તે બહુજ જુની વાત હશે. ત્યારે અમને ખુબજ દુઃખ લાગે છે કે અમે આ કોને કહેવા જઈએ અને હકીકત જોતા જેમ આજનો સનાતની યુવા વર્ગ આ બધી બાબતો થી અજાણ હતો એમ અમારો સતપંથી યુવા વર્ગ પણ અજાણ હતો અને છીયે. એટલે આમા નવ યુવાનો ન ઉશ્કેરાતા અમને થોડો સમય આપો અને સાથ આપો તો ઘણું સારૂં પરિણામ આવી શકે.

ખારઘર (નવી મુંબઈ) માં વસતા એક અગ્રણી સતપંથી બીલ્ડરે ત્યાં સુધી કહ્યું કે અમને છ એક મહીના

realpatidar.com

https://archive.org/details/bk912/page/n3/mode/1up

realpatidar.com

નો સમય આપો તો અમે ગુજરાત-કંપા, કચ્છમાં રહેતા અમારા ભાઈઓ ના અગ્નિ સંસ્કાર ની બાબતમાં સહમતી ના લીસ્ટ બનાવી આપી દઈએ અને કેન્દ્રીય સમાજના આજના પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલા અમને મળવાની ઈચ્છા કરશે તો અમે અવશ્ય મળશું જે કોઈ કેસો થયા છે તેની બાબતમાં ચર્ચા કરી નિકાલ કરવાનો રસ્તો કાઢશું. ઘણાનું કહેવું એમ છે કે મુંબઈમાં વસતા સતપંથી ભાઈઓ અને કચ્છ ગુજરાતમાં વસતા ભાઈઓ માં ઘણો ફરક છે. કચ્છ - ગુજરાતની સ્થિતિ કંઈક જુદી છે તો તેની બાબતમાં મુંબઈમાં રહેતા સતપંથી ભાઈઓ એ બાબતની જવાબદારી સંભાળી લે તો તેમને સમય આપવામાં સનાતની ભાઈઓ એ અવશ્ય વિચારવું જોઈએ. મીટીંગ કરવા સતપંથી ભાઈઓ તૈયાર જ છે.

હું મા ઉમીયા મા નું નામ લઈ તેમના આશિર્વાદ લઈ એકતા માટે નો પ્રયાસ એટલા માટે કરૂં છું કેમ કે વેર ઝેર રાખીને સમાજ જો તુટશે તો કાલે આપણી આવવાવાળી પેઢીઓને ઘણુ સહન કરવાનું આવશે જેઓ બિલકુલ નિર્દોષ હશે. અસમાજીક તત્વો પણ આનો ગેરલાભ લેવાનું ચુકશે નહી. જયાં જયાં સયુંક્ત મિલ્કતો છે ત્યાં પણ અસર પડશે. દીકરીઓ સુખી થશે કે દુઃખી થશે તે તો આખી કચ્છ કડવા પાટીદાર સમાજે વિચારવાનું રહેશે.

પ્રેરણા પીઠ ના ટ્રસ્ટી તથા ગુજરાત કંપા ના ઘણા બીલ્ડરો જે ખારઘર નવી મુંબઈ માં વસે છે તેમનો આ પરિસ્થિતીમાં ઉકેલ આવે તે માટે પુરો સહકાર આપવા તૈયાર જ છે. અને મને પણ પુરો આત્મવિશ્વાસ છે કે આમાં આપણે ઘણું ઘણું જ આપણી સમાજની એકતા માટે મેળવી શકીશું. આગળ જે ફક્ત વાતો કે પ્રયાસ થયા છે તેવું નહી થાય, ઠોસ પરિણામ આવશે જ.

મારો પ્રયાસ કે મારા વિચાર થી કોઈ વડીલ ને કે કોઈપણ આપણી સમાજનાં સદસ્યને ઠેસ પહોંચી હોય તો મને માફ કરશો. મને કોઈ વઢશે તો વઢ ખાવા તૈયાર છું પણ ન બોલી ને મારી આત્મા ઉપર હું બોજો રાખવા નથી માગતો. જેમ દરેક કોઈનું મૃત્યુ નિશ્ચિત છે તેમ મારૂ પણ મૃત્યુ નિશ્ચિત જ છે. હું જ્યારે જઈશ ત્યારે મારી અંતિમ ઘડીઓમાં સમાજની એકતા ની બાબતમાં મારી આંખોમાં દુઃખના નહી પણ હર્ષના આશુ હોય તેવી મારી ઈચ્છા મા ઉમીયા મા પુરી કરે તેવા આશિષ માગું છું.

જે ગામો માં કેસો થયેલા છે જેમકે ગઢવાળી નાની વિરાણી વગેરે તથા મોડાસા માં મા ઉમીયા મા નું મંદિર જ્યાં જે ભાઈઓ - વડીલો આ કેસો માં સંકળાયેલા છે તેઓ ને મારી નમ્ર વિનંતિ છે કે આનો જલ્દીમાં જલ્દી કંઈક ઉકેલ આવે તેવો સંકલ્પ કરવો જોઈએ અરસ પરસ અહમ. જીદ, અહંકાર છોડી હૃદયમાં સાચા ભાઈચારાનો પ્રેમ પ્રગટાવશું તો આનો સહજતતા થી ઉકેલ આવી જશે તેવો મને પૂરે પૂરો વિશ્વાસ છે.

મારા આગળના બે લેખ જે 'પાટીદાર સંદેશ' માં પ્રગટ કરવામાં આવ્યા હતા તેના પ્રતિસાદ રૂપે મને કોઈપણ સનાતની ભાઈઓનો વિરોધ નો ફોન નથી આવ્યો. તે માટે મારા સનાતની ભાઈઓનો ખુબજ ઋણી છું અને આપણી સમાજ માં એકતા જઈવાઈ રહે તેવી તેમની અંદર થી લાગણી છે તે સ્પષ્ટ થાય છે. અને હવે આની ગંભીરતા સમજી ને સતપંથી ભાઈઓ પુરે પુરો હૃદયપુર્વક સહકાર આપે અને સનાતની ભાઈઓ જુની કડવાશ ભુલી ફરી થી મીટીંગ ગોઠવવાનું કરે તો રસ્તો નીકળી જશે.

હું આપણી સમાજ ને એક નાની વ્યક્તિ થઈ ને ઉપદેશ કે આ પરિસ્થિતી માં થી રસ્તો કાઢવાનું ન કહેત. જો કચ્છ કડવા પાટીદાર સમાજ ની કોઈપણ દીકરી રડી ન હોત. જેને આપણે નિયાણી તરીકે નું માન આપીએ છીએ તેને જ રડીવીને આપણે આપણા અહમ, અહંકાર, જીદ ને પોષી રહ્યા છીએ. આપણે આનંદ લઈ રહ્યા છીએ.

જ્યારે આપણી કે કોઈપણ સમાજની વ્યક્તિ ગુજરી જાય અને હું જો તે સ્મશાન યાત્રામાં ગયો હોઉ. ત્યારે અર્થીની સ્મશાન યાત્રા શરૂ થાય ત્યાર થી અંતિમ સ્મશાન ભૂમિના પડાવ સુધી અર્થીની સાથે ને સાથે અર્થીની ફરતે ફરૂ છું અને જે કોઈ કાંધ આપવા વાળો થાકી ગયેલો લાગે તેની પાસે થી અર્થી લઈ મારી કાંધ આપું છું. આ મારો પહેલે થી સ્વભાવ છે કે આચરણ છે. ઘરના કે કુટુંબની જે વ્યક્તિઓ યા યાત્રામાં હોય છે તેઓ કેટલા માનસિક તથા શારીરીક થાકેલા હોય છે. છેલ્લા કેટલાક કલાકો થી ખાદ્યુ પીધુ, પણ ન હોય તે સમયે તેઓ ને ટેકા ની કે મદદની જરૂર કે આવશ્યકતા હોય છે જે હું જીવતા માણસ ને ભગવાન તરીકે માની તેમની મદદે રહું છું. કારણ કે જવાવાળી વ્યક્તિ તો જતી રહે છે તે તો હવે એક મૃત શરીર છે તેતો એક ઈતિહાસ છે. હું તો ફક્ત વર્તમાન સમયમાં જ માનું છું.

મને માફ કરશો કદાચ કોઈના હૃદયનો ઠેસ પહોંચી હોય તો. મારા વિચાર, મારા ભાવ નો સાક્ષિ મારો ભગવાન છે, મા ઉમીયા મા છે. જે સૌ કોઈના હૃદયમાં વસે છે.

છેલ્લે હું આખી સમાજને હૃદયપૂર્વક, પુરા ભાવથી વિનંતિ કરૂ છું કે હજી પાંચેક વર્ષનો સમય જવા દો. સંબંધ પહેલા ની જેમ જાળવી રાખો. નિયાણીઓના આશિર્વાદ મેળવો, ઉતાવળ કરી અહ્મ, જીદ રાખી ભગવાન ને નારાજ કરી, કોઈ કર્મોમાં બંધાઈ ન જઈએ.

|| જય માતાજી ||

મનોજ તુલસીદાસ શિવદાસ નાકરાણી
રૂમ નં. ૧૨, પટેલ સદન, તિલક રોડ,
ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૭૭.
મો.નં.: ૦૯૩૨૩૬ ૫૪૦૯૪

realpatidar.com

realpatidar.com

।। જય ઉમિયા મા ।।

-: સૌજન્ય :-

મનોજ તુલસીદાસ શીવદાસ નાકરાણી

મોટી વિરાણી (નખત્રાણા)

ઘાટકોપર - મુંબઈ

મો.: ૯૩૨૩૬૫૪૦૯૪

realpatidar.com

https://archive.org/details/bk912/page/n5/mode/1up

realpatidar.com

"કુંવારી દિકરીઓ જોગ"

કચ્છ કડવા પાટીદાર સમાજની દરેક કુંવારી દિકરીઓ એ નિત્ય ઉમિયા મા ને કરવા જેવી પ્રાર્થના.

હું તમારી દિકરી છુ અને હમેંશા તમારી દિકરી બનીને જ રહુ એવા મને આશીર્વાદ આપો. મારા મા-બાપે મને કેટલા પ્રેમ અને હેત થી મોટી કરી છે. તે મારે ધ્યાનમાં રાખવુ જોઇએ. મને કોલેજમાં મોકલાવીને ભણવાની મારી ઇચ્છા પુરી કરી છે (તેમના મનમાં ડર અને ચીંતા હોવા છતાં) મોબાઇલ ફોન માટે પણ ના નથી પાડી મને ક્યારેય એમ નથી જણાયું કે હું દિકરી છું મને દિકરા જેવો જ પ્રેમ મળ્યો છે. એટલે ઉમિયા મા! હું તમને હૃદયપૂર્વક પ્રાર્થના કરુછુ. મને જે સ્વતંત્રતા મળી છે તેના બદલા રૂપી હું એવુ ક્યારેય પણ પગલુ ન ભરૂ જેનાથી મારા

realpatidar.com

https://archive.org/details/bk912/page/n6/mode/1up

realpatidar.com

મા-બાપ ને, મારા સગાં-સંબંધીઓને કે મારી સમાજ ને નીચા જોવા પણુ થાય હું મારી ઉપર સંયમ રાખું, મારા મા-બાપની લાજ ને ઠેસ ન પહોંચાડું, ઉંમર દોષને લીધે ક્યારેય કોઇ પરધર્મી છોકરા સામે જોઇશ પણ નહી. ક્યારેય પણ અણ સમજણતામાં ભવિષ્યનો નિર્ણય ન લઉં. મારા મા-બાપનો મારી ઉપરનો અતૂટ વિશ્વાસ ન તોડું.

મેં સાંભળ્યુ છે કે જે જે દિકરીઓએ ખોટા નિર્ણયો લીધા છે, અને ઘેર થી ભાગી ને લગ્ન કર્યા છે, તેને પસ્તાવા સિવાય કંઇ જ મળ્યું નથી અને ઉપરથી બદનામી તથા મા-બાપને દિકરીને છુટ-સ્વતંત્રતા આપવાનો પસ્તાવો. આ પ્રાર્થના, માના આશીર્વાદ રૂપે હંમેશા હું મારી પાસે મારા હૃદયમાં રાખીશ તેવો સંકલ્પ કરું છું.

જય માતાજી

realpatidar.com

https://archive.org/details/bk912/page/n7/mode/1up

realpatidar.com

।। શ્રી ભગવતી સ્તોત્રમ્ ।।

ખમ્મા ખમ્મા ખમ્મા માને ઘણી ખમ્મા,
મારી ઉમીયા માને જાઝી ખમ્મા ।
મારી કુળદેવી માને જાઝી ખમ્મા,
મારી અંબે માને ઘણી ખમ્મા ।।૧।। ...ખમ્મા
જય ભગવતિ દેવિ નમો વરદે,
જય પાપ વિનાશિની બહુ ફલ દે ।
જય શુંભ નિશુંભ કપાલધરે,
પ્રણમામિ તુ દેવિ નરાર્તિહરે ।।૨।। ...ખમ્મા
જય ચન્દ્ર દિવાકર નેત્ર ધરે,
જય પાવક ભૂષિત વક્તવરે ।
જય ભૈરવ દેહ નિલીન પરે,
જય અન્ધક દૈત્ય વિશોષ કરે ।।૩।।...ખમ્મા
જય મહિષવિમર્દિની શૂલ કરે,
જય લોક સમસ્ત ક પાપ હરે,
જય દેવિ પિતામહ વિષ્ણુનતે,
જય ભાસ્કર શક શિરોડવનતે ।।૪।।...ખમ્મા
જય ષન્ણામુખ સાયુધ ઈશાનુતે,
જયસાગર ગામિનિ શુંભુનુતે ।
જય દુઃખ દરિદ્ર વિનાશ કરે,
જય પુત્ર કલત્ર વિ વૃદ્ધિ કરે ।।૫।।...ખમ્મા
જય દેવિ સમસ્ત શરીર ધરે,
જય નાક વિદર્શિનિ દુઃખ હરે ।
જય વ્યાધિ વિનાશિનિ મોક્ષ કરે,
જય વાંછિત દાયિનિ સિદ્ધિ વરે ।।૬।।...ખમ્મા

realpatidar.com